



सत्यमेव जयते

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LXVI]

WEDNESDAY, MARCH 5, 2025 / PHALGUNA 14, 1946

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART IV-C

Statutory Rules and Orders (Other than those published in Parts I, I-A and I-L) made by Statutory Authorities other than the Government of Gujarat including those made by the Government of India, the High Courts, the Director of Municipalities, the Commissioner of Police, the Director of Prohibition and Excise, the District Magistrates and the Election Commission, Election Tribunals, Returning Officers and other authorities under the Election Commission.

GUJARAT ELECTRICITY REGULATORY COMMISSION

NOTIFICATION NO.5 OF 2025

Gandhinagar, Gujarat

No.GERC/2025/05/Admin/331:- In exercise of the power conferred under sub-section (6) of Section 42 of the Electricity Act, 2003 (36 of 2003) and in pursuance of Section 3.7 of the Gujarat Electricity Regulatory Commission (Establishment of Ombudsman) Regulations, 2019 (Notification No.2 of 2019), the Commission hereby reappoints Shri S. H. Upadhyay, as Electricity Ombudsman (Rajkot) for the purpose of the Act and the relevant regulations, for a further period of 1 (One) year with effective from 8th March, 2025.

By order and in the name of the Gujarat Electricity Regulatory Commission.

RANJEETH KUMAR J., IAS

Secretary,
GERC, Gandhinagar.

Date: 04/03/2025

Place: Gandhinagar

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

જાહેરનામા નં.૫/૨૦૨૫

ગાંધીનગર, ગુજરાત

No. GERC/2025/05/Admin/331:- વીજળી અધિનિયમ, ૨૦૦૩ની કલમ-૪૨ની પેટા-કલમ (દ) હેઠળ આપવામાં આવેલી સત્તાઓના ઉપયોગમાં (૩૬ ની ૨૦૦૩) અને ગુજરાત વીજળી નિયમનકારી આયોગ (લોકપાલની સ્થાપના) નિયમો/જાહેરનામા નં.૨/૨૦૧૯ ની કલમ-૩.૭ ને અનુસરીને ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા કાયદા અને નિયમો સંબંધિત હેતુસર શ્રી એસ. એચ. ઉપાધ્યાય, વિદ્યુત લોકપાલ (અમદાવાદ) તરીકે તારીખ:૦૮-૦૩-૨૦૨૫ થી અમલમાં આવે એ રીતે ૦૧ (એક) વર્ષના સમયગાળા માટે પુનઃ નિમણૂક કરી.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના હુકમથી,

રંજીથકુમાર જે., આઈ.એ.એસ.

સચિવ,

જીઈઆરસી, ગાંધીનગર

તારીખ: ૦૪/૦૩/૨૦૨૫

સ્થળ: ગાંધીનગર

